

ત્વરિત જાહેરાત માટે

સીટીના રાષ્ટ્રીય યુવા સપ્તાહ (National Youth Week)ના રોમાંચક પ્રસંગોમાં હાજરી આપવી ચુકથો નહીં

પ્રસંગોમાં સામેલ છે ડીજે પૂલ પાર્ટી, આઉટડોર મૂવી નાઈટ અને તમારા ભવિષ્ય માટેની યોજનાઓ ઘડવા વિષયક પ્રવૃત્તિઓ.

બ્રમ્પટન, ઓન્ટારિયો (15 એપ્રિલ 2019) – હાથમાં લઈ લો તમારો સ્વિમસૂટ, ઓઢવાની ચાદર અને એક નોટબૂક!

આ વર્ષે, રાષ્ટ્રીય યુવા સપ્તાહ (National Youth Week) નું આયોજન મે 1થી 7 સુધી થયું છે અને સીટી ઓફ બ્રમ્પટન તે આનંદ ઉલ્લસથી અને નિ:શુલ્ક પ્રસંગો યોજીને ઉજવી રહ્યું છે.

આ છે પ્રવૃત્તિઓની યાદી.

ડીજે પૂલ પાર્ટી

- શુક્રવાર, મે 3 | સાંજે 7:30 થી 8:30

10 થી 18 વચ્ચેના યુવાધનને DJ અને પૂલના ઈન્ફ્લેટેબલ્સ જેવી વસ્તુઓ સહિતની ઉજવવામાં આવનાર પૂલ પાર્ટીમાં ગોર મેડોઝ કમ્યુનિટી સેંટર ખાતે આમંત્રણ આપવામાં આવે છે.

આઉટડોર મૂવી નાઈટ

- શનિવાર, મે 4 | સાંજે 8:30 વાગ્યે*

10 થી 18 વચ્ચેનું યુવાધન મફત પોપકોર્ન અને ડ્રિંક્સ સાથેની એક આઉટડોર મૂવી નાઈટ માટે સેંચુરી ગાર્ડન્સ પાર્ક પર પોતાના બ્લૉકેટ્સ અને ખુરશીઓ લઈને આવી શકે છે.

*પોતાની જગ્યા મેળવી લેવા કૃપા કરીને સાંજે 8 વાગ્યા સુધીમાં આી રહેશો.

તમારા ભવિષ્યનું આયોજન

- રવિવાર, મે 5 | સાંજે 4:30 થી 6:30

14 થી 18 વચ્ચેના યુવાનો ગેસ્ટ સ્પીકર, રેઝ્યુમે લેખન વર્કશોપ, ઈન્ટરવ્યૂ કોશલ્યો અને સૂચનોની વર્કશોપ, રોજગાર મેળો, અને મફત પિત્ઝા માટે કેસિ કેમ્પબેલ કમ્યુનિટી સેંટર (Cassie Campbell Community Centre) પર અમારી સાથે જોડાઈ શકે છે.

યૂથ નાઈટ્સ

સીટી 6 થી 17 વર્ષની વયના યુવાન લોકો માટે સાપ્તાહિક યૂથ નાઈટ્સના યજમાન બની રહ્યા છે. દર શુક્રવારે વ્યક્તિ દીઠ \$2માં સાંજે 6 થી 9 સુધી યુવાનોને રમતગમત, ડાન્સિંગ અને રમતો રમવા સાથે બીજી ઘણી બધી વસ્તુઓ માણવા ત્રણ બ્રેમ્પટન રિક્રિએશન સેંટરો પર આવવાનું આમંત્રણ છે: કેસિ કેમ્પબેલ કમ્યુનિટી સેંટર (Cassie Campbell Community Centre), સેંચુરી ગાર્ડન્સ રિક્રિએશન સેંટર (Century Gardens Recreation Centre) અને ગોર મેડોઝ કમ્યુનિટી સેંટર (Gore Meadows Community Centre). યૂથ નાઈટ્સ વિશે વધુ જાણકારી મેળવવા અહીં મુલાકાત લો www.brampton.ca/youth.

ક્વોટ

"અહીં બ્રેમ્પટનમાં, અમારે અમારા યુવાનો માટે તેઓને શીખવાની, વિકસવાની અને રમવાની તકો પૂરી પાડીને એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર બનાવવું છે. રાષ્ટ્રીય યૂથ સપ્તાહ એટલે યુવાનોને વધાવી લેવાનો જોરદાર માર્ગ છે જેમાં એ લોકોને ગમ્મતભરી અને નિ:શુલ્ક પ્રવૃત્તિઓ આપવામાં આવે – પછી તે આઉટડોર મૂવી નાઈટ હોય કે કારકિર્દી આયોજન હોય કે મનોરંજનથી ભરપૂર પૂલ પાર્ટી હોય – જેથી યુવાનો આનંદ લેતા લેતા તેમાં સામેલ થવા પ્રોત્સાહિત થાય.

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

સીટી ઓફ બ્રેમ્પટન વિશે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca અથવા અમને ફોલો કરો [Twitter](https://twitter.com/Brampton) પર, [Facebook](https://facebook.com/Brampton) પર, અને [Instagram](https://instagram.com/Brampton) પર.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca